

ગુજરાત જાહેર સેવા આયોગ

લેકચરર સિનિયર સ્કેલ (રીડર)(આયુ.) (કાયચિકિત્સા)જાહેરાત ક્રમાંક.૩૦/૧૭-૧૮માં અપાત્ર

ઉમેદવારોની યાદી

આયોગ દ્વારા પ્રસિધ્ધ થયેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ સરકારી આયુર્વેદ કોલેજોમાં વિવિધ વિષયના લેકચરર સિનિયર સ્કેલ (રીડર)(આયુ.)(કાયચિકિત્સા) આયુર્વેદ સેવા વર્ગ-૧ (જાહેરાત ક્રમાંક ૩૦/૧૭-૧૮) ની કુલ:૦૪ જગ્યાઓ ઉપરની ભરતી માટે આયોગ દ્વારા ઓનલાઇન કન્ફર્મ થયેલ અરજીઓની ચકાસણીને અંતે ઓનલાઇન અરજી ક્રમાંક પ્રમાણે અપાત્ર ઉમેદવારોની યાદી તા.૧૯-૦૪-૨૦૧૭ના રોજ પ્રસિધ્ધ કરેલ હતી. જેમાં **Dr.Sejal Harshit Shah, conformation No.37602810** ની પાત્રતા/અપાત્રતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો અભિપ્રાય મળ્યા બાદ નિર્ણય કરી પ્રસિધ્ધ કરવામાં આવશે તેમ દર્શાવેલ છે. નીચે દર્શાવ્યા મુજબની વિગતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અભિપ્રાયને આધીન તેઓ અપાત્ર જાહેર થાય છે જેથી તેઓ પ્રાથમિક કસોટીમાં પ્રવેશ ને પાત્ર બનતા નથી:-

નોંધ:

૧	તા.૧૬-૦૭-૨૦૦૩ થી તા.૦૭-૦૪-૨૦૦૮ના સમયગાળાના અરજી મુજબ ૪.૧ વર્ષના તા.૨૧-૦૭-૨૦૦૮ના અનુભવમાં અધ્યાપનના વિષયનો ઉલ્લેખ નથી. આમ, ભરતી નિયમ, મુજબ નિયત વિષયના માંગેલ અનુભવને સુસંગત ન હોવાથી આ અનુભવ માન્ય ગણવા પાત્ર નથી
૨	ઉમેદવારે રજુ કરેલ તા.૧૦/૯/૨૦૦૮ થી તા.૧૯/૬/૨૦૦૯ના સમયના (૦૯ માસ ૧૦ દિવસ) તા.૨૪/૪/૨૦૧૭ના રોજના અનુભવના પ્રમાણપત્રમાં “ સ્વસ્થ વૃત્ત “ વિષયમાં કરેલ અધ્યાપનનો અનુભવ ભરતી નિયમ મુજબ કાયચિકિત્સા વિષયની જાહેરાત ક્રમાંક ૩૦/૨૦૧૭-૧૮ માટે માન્ય ગણાશે નહીં.
૩	ઉમેદવારે અરજીમાં તા.૨૩/૬/૨૦૧૧ થી તા.૨૪/૫/૨૦૧૨ સમયના વ્યાખ્યાતા તરીકેનો અનુભવનો (૧૧ માસ ૨ દિવસ) વર્ષ) ઉલ્લેખ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ, અમદાવાદ ખાતે દર્શાવેલ છે પણ આ અંગેનું કોઈ પ્રમાણપત્ર અરજી સાથે સામેલ કરેલ નથી. આમ આ અનુભવ માન્ય ગણવાપાત્ર નથી.

૪	<p>ઉમેદવારે અરજીમાં તા.૨૫/૫/૨૦૧૨ થી તા.૨૨/૫/૨૦૧૭ (૫ વર્ષ)નો રિસર્ચ ઓફિસર તરીકેનો અનુભવ દર્શાવ્યો છે. તે અનુસંધાને તા.૧/૬/૨૦૧૭ના રોજનું અનુભવનું પ્રમાણપત્ર પણ બિડેલ છે. પણ નીચેની હકીકત જોતાં રિસર્ચ ઓફિસરનો માત્ર ૪.૧ વર્ષનો જ અનુભવ માન્ય ગણવાપાત્ર છે.</p> <p>(૪.૧) આરોગ્ય વિભાગે આધારો સાથે સ્પષ્ટતા કર્યા મુજબ તા.૨૩/૫/૨૦૧૨ના કાર્યાલય આદેશથી તેમની બદલી સંશોધન અધિકારીની જગ્યાએ કરેલ પણ વહીવટી કારણોસર તેઓ આ સંશોધન અધિકારીની જગ્યા પર તાત્કાલિક નહિ પણ છેક તા.૧૦/૪/૨૦૧૩ના રોજ હાજર થયેલ છે અર્થાત આ સમયગાળાનો (તા.૨૫/૫/૨૦૧૨ થી તા.૯/૪/૨૦૧૩ સુધી = ૧૦ માસ ,૧૫ દિવસ) તેમનો અનુભવ સ્વસ્થવૃત્ત વિષયના ડેપ્યુટી લેક્ચરર (મેડિકલ ઓફિસર) તરીકેનો જ ગણાય. આ ૧૦ માસ અને ૧૫ દિવસનો રિસર્ચ ઓફિસરનો માન્ય અનુભવ ગણવાપાત્ર નથી.</p> <p>(૪.૨) ઉમેદવારે રજૂ કરેલ તા.૧/૬/૨૦૧૭ના રોજના અનુભવના પ્રમાણપત્રમાં દર્શાવ્યા મુજબ તા.૧૦/૪/૨૦૧૩ થી તા.૨૨/૫/૨૦૧૭ (૪ વર્ષ -૧ માસ -૨૧ દિવસ)નો રિસર્ચ ઓફિસરનો અનુભવ માન્ય અનુભવ ગણવાપાત્ર થાય પણ ભરતી નિયમ મુજબ નિયત કરેલ ૫ વર્ષનો થતો નથી.</p>
---	--

- ઉપરોક્ત વિગતે તેઓ ભરતી-નિયમ મુજબ નિયત સમયનો શૈક્ષણિક અથવા રિસર્ચનો અનુભવ ધરાવતા ન હોવાથી અપાત્ર જાહેર કરવામાં આવે છે.
- અપાત્રની યાદી જાહેર કર્યા બાદ આયોગ દ્વારા કોઈ પણ ઉમેદવારોના અરજીપત્રક / પ્રમાણપત્રો સ્વીકારવામાં આવશે નહીં.

સહી

(એચ. એસ. ભાયાણી)

સેક્શન અધિકારી

ગુજરાત જાહેર સેવા આયોગ